

પરમ-સમાધિ અધિકાર

હવે સમસ્ત મોહરાગદેખાટ પરભાવોના વિધવંસના ડેતુભૂત પરમ-સમાધિ અધિકાર કહેવામાં આવે છે.

આ, પરમ સમાધિના સ્વરૂપનું કથન છે.

વચનોચ્ચરણકિરિયા તજી, વીતરાગ નિજ પરિણામથી
ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૨૨.

અન્વયાર્થ:— વચનોચ્ચરણની કિયા પરિત્યાગીને વીતરાગ ભાવથી જે આત્માને ધ્યાવે છે, તેને પરમ સમાધિ છે. ॥૧૨૨॥

અહીં (આ ગાથામાં) સમાધિનું લક્ષણ (અર્થાત् સ્વરૂપ) કહ્યું છે.
સંયમ, નિયમ ને તપ થકી, વળી ધર્મ-શુક્લધ્યાનથી,
ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૨૩.

અન્વયાર્થ:— સંયમ, નિયમ ને તપથી તથા ધર્મધ્યાન ને શુક્લધ્યાનથી જે આત્માને ધ્યાવે છે, તેને પરમ સમાધિ છે. ॥૧૨૩॥

અહીં (આ ગાથામાં), સમતા વિના દ્રવ્યલિંગધારી શ્રમણાભાસને
કિંચિત્તુ પરલોકનું કારણ નથી (અર્થાત્ જરાય મોક્ષનું સાધન નથી) એમ
કહ્યું છે.

વનવાસ વા તનકલેશરૂપ ઉપવાસ વિધવિધ શું કરે?
રે! મૌન વા પઠનાટિ શું કરે સાભ્યવિરહિત શ્રમણને? ૧૨૪.

અન્વયાર્થ:— વનવાસ, કાયકલેશરૂપ અનેક પ્રકારના ઉપવાસ,
અધ્યયન, મૌન વગેરે (કાર્યો) સમતારહિત શ્રમણને શું કરે છે (-શો
લાભ કરે છે)? ॥૧૨૪॥

અહીં (આ ગાથામાં), જે સર્વ સાવદ્ધ વ્યાપારથી રહિત છે, જે ત્રિગુપ્તિ વડે ગુપ્ત છે અને જે સમસ્ત ઈન્દ્રિયોના વ્યાપારથી વિમુખ છે, તે મુનિને સામાયિકત સ્થાયી છે એમ કહ્યું છે.

સાવદ્ધવિરત, ત્રિગુપ્ત છે, ઈન્દ્રિયસમૂહ નિરુદ્ધ છે,
સ્થાયી સમાયિક તેહને ભાષ્યું શ્રી કેવળીશાસને. ૧૨૫.

અન્વયાર્થ:—જે સર્વ સાવદ્ધમાં વિરત છે, જે ત્રણ ગુપ્તિવાળો છે અને જેણે ઈન્દ્રિયોને બંધ (નિરુદ્ધ) કરી છે, તેને સમાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. ॥૧૨૫॥

અહીં, પરમ માધ્યસ્થભાવ વગેરેમાં આરૂઢ થઈને રહેલા પરમમુક્તિનું સ્વરૂપ કહ્યું છે.

સ્થાવર અને ત્રસ સર્વ ભૂતસમૂહમાં સમભાવ છે,
સ્થાયી સમાયિક તેહને ભાષ્યું શ્રી કેવળીશાસને. ૧૨૬.

અન્વયાર્થ:—જે સ્થાવર કે ત્રસ સર્વ જીવો પ્રત્યે સમભાવવાળો છે, તેને સમાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. ॥૧૨૬॥

અહીં (આ ગાથામાં) પણ આત્મા જ ઉપાદેય છે એમ કહ્યું છે.

સંયમ, નિયમ ને તપ વિષે આત્મા સમીપ છે જેહને,
સ્થાયી સમાયિક તેહને ભાષ્યું શ્રી કેવળીશાસને. ૧૨૭.

અન્વયાર્થ:—જેને સંયમમાં, નિયમમાં અને તપમાં આત્મા સમીપ છે, તેને સમાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
॥૧૨૭॥

અહીં, રાગદ્રોષના અભાવથી અપરિસ્પંદરૂપતા હોય છે એમ કહ્યું છે.

નહિ રાગ અથવા દ્રોષરૂપ વિકાર જન્મે જેહને,
સ્થાયી સમાયિક તેહને ભાષ્યું શ્રી કેવળીશાસને. ૧૨૮.

અન્વયાર્થ:—જેને રાગ કે દેખ (નહિ ઉપજતો થકો) વિકૃતિ ઉત્પન્ન કરતો નથી, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. ॥૧૨૮॥

આ, આર્ત અને રૌદ્ર ધ્યાનના પરિત્યાગ દ્વારા સનાતન (શાશ્વત) સામાયિકતના સ્વરૂપનું કથન છે.

જે નિત્ય વર્જ આર્ત તેમ જ રૌદ્ર બન્ને ધ્યાનને,
સ્થાયી સમાયિક તેહને ભાષ્યું શ્રી કેવળીશાસને. ૧૨૯.

અન્વયાર્થ:—જે આર્ત અને રૌદ્ર ધ્યાનને નિત્ય વર્જ છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. ॥૧૨૯॥

આ, શુભાશુભ પરિણામથી ઉપજતાં સુકૃતહૃદૃતરૂપ કર્મના સંન્યાસની વિધિનું (-શુભાશુભ કર્મના ત્યાગની રીતનું) કથન છે.

જે નિત્ય વર્જ પુષ્ય તેમ જ પાપ બન્ને ભાવને,
સ્થાયી સમાયિક તેહને ભાષ્યું શ્રી કેવળીશાસને. ૧૩૦.

અન્વયાર્થ:— જે પુષ્ય તથા પાપરૂપ ભાવને નિત્ય વર્જ છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. ॥૧૩૦॥

આ, નવ નોકષાયના વિજય વડે પ્રાપ્ત થતા સામાયિકચારિત્રના સ્વરૂપનું કથન છે.

જે નિત્ય વર્જ હાસ્યને, રતિ અરતિ તેમ જ શોકને,
સ્થાયી સમાયિક તેહને ભાષ્યું શ્રી કેવળીશાસને. ૧૩૧.

જે નિત્ય વર્જ ભય જુગુપ્સા, વર્જતો સૌ વેદને,
સ્થાયી સમાયિક તેહને ભાષ્યું શ્રી કેવળીશાસને. ૧૩૨.

અન્વયાર્થ:—જે હાસ્ય, રતિ, શોક અને અરતિને નિત્ય વર્જ છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. ॥૧૩૨॥

જે જુગુખા, ભય અને સર્વ વેદને નિત્ય વર્જે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. ॥૧૩૨॥

આ, પરમ-સમાધિ અધિકારના ઉપસંહારનું કથન છે.

જે નિત્ય ધ્યાવે ધર્મ તેમ જ શુક્લ ઉત્તમ ધ્યાનને,
સ્થાયી સમાયિક તેહને ભાષ્યું શ્રી કેવળીશાસને. ૧૩૩.

અન્વયાર્થ:—જે ધર્મધ્યાન અને શુક્લધ્યાનને નિત્ય ધ્યાવે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. ॥૧૩૩॥

આ રીતે, શ્રીમહાભગવતુંદુંદાચાર્યદેવપ્રાણીત શ્રી નિયમસાર પરમાગમનો પરમ-સમાધિ અધિકાર નામનો નવમો શુતર્સર્કંધ સમાપ્ત થયો.

